

# એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ

બીજો માળ, એસીપીસી બિલ્ડીંગ, એલ.ડી. કોલેજ ઓફ એન્જી. કેમ્પસ, અમદાવાદ : ૩૮૦૦૧૫ ફોન : ૦૭૯ - ૨૬૩૦૫૫૧૬

આઈ.ટી.આઈ./ટેકનિકલ પરીક્ષા બોર્ડ/ઇન્ડોજર્મન ટુલ રુમ્સ માન્ય સર્ટીફિકેટ હોલ્ડર્સને  
ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમના બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં પ્રવેશ વર્ષ : ૨૦૨૧-૨૨

ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં સીધા પ્રવેશ માટે, ધો.૧૦ +NCVT અથવા GCVT અથવા TEB અથવા IGTR ધ્વારા માન્ય બે વર્ષનો સર્ટીફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળાંત પરીક્ષા (ધો.૧૦) ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તિર્ણ કરેલ હોય તેવા પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટે, સરકારશ્રી દ્વારા હાલની નોવેલ કોરોના વાયરસ (COVID-19) ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ તેના સંક્રમણને અટકાવવા માટે તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શન સૂચનાઓનો ચૂસ્તપણે અમલ થાય તે હેતુ થી રાજ્ય સરકારની સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે પ્રવેશ વર્ષ : ૨૦૨૧ માં પણ ગતવર્ષની જેમ જ વેબ બેઝડ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરેલ છે. પ્રવેશવાંચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

(1) સમિતિની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ એપેન્ડીક્ષ -૧(પરિશિષ્ટ-૧) માં દર્શાવેલ આઈ.ટી.આઈ./ ટીઈબી / આઈજીટીઆરનો બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલ ઉમેદવારો જ તત્સમાન ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.

(2) ઓનલાઇન રજીસ્ટ્રેશન [www.gujdiploma.nic.in](http://www.gujdiploma.nic.in) ની વેબસાઇટ પર તારીખ 01/07/2021 થી 15/07/2021 સુધીમાં કરવાનું રહેશે.

(3) ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ઉમેદવારો ઇન્ટરનેટ સુવિધાવાળા મોબાઇલ/કોમ્પ્યુટર/લેપટોપ/ટેબલેટ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની સરળ સમજૂતી માટે [www.acpdc.co.in](http://www.acpdc.co.in) અને [www.gujdiploma.nic.in](http://www.gujdiploma.nic.in) પર ઇ-માહિતી પુસ્તિકા અને વિડિઓ લીંક ઉપલબ્ધ છે.

(4) રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે [www.gujdiploma.nic.in](http://www.gujdiploma.nic.in) પર સંપૂર્ણ વિગત ભરી, જરૂરી દસ્તાવેજો ઉપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે 200 રૂ. ઓનલાઇન પેમેન્ટ કરવાના રહેશે. આ અંગેની કોઈપણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પ લાઇન નંબર 079- 26566000 (24x7) પર આપ સંપર્ક કરી શકો છો. ઉમેદવાર સમિતિની વેબસાઇટ પર ભરેલ રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશે.

(5) ઓનલાઇન પ્રવેશની લગતી તમામ માહિતી જેવીકે સરકારી/અનુદાનિત/સ્વનિર્ભર સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ગતવર્ષના જે તે સંસ્થાની જે તે શાખામાં અંતિમ પ્રવેશના માર્ક/મેરીટ નંબરની યાદી, રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી ઉપરોક્ત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને ફોર્મ ભરતા પહેલાં વાંચી લેવાની રહેશે.

(6) સમિતિની વેબસાઇટ તથા ઇ-બુકલેટ માં દર્શાવવામાં આવેલ KEY Dates (પ્રવેશ કાર્યક્રમ સારણી) પ્રમાણે આગળની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

(7) ઉમેદવારોએ ભરેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મના સમિતિ દ્વારા કરવામાં આવતા વેરીફિકેશન દરમિયાન જો કોઈ વિસંગતતા જણાશે તો કવેરી જનરેટ થશે અને જે તે ઉમેદવાર ને આ બાબતની જાણ તેઓના રજીસ્ટર્ડ ઇમેઇલ અને મોબાઇલ પર કરવામાં આવશે અને તેની પૂર્તતા માટે ઉમેદવારે તેમની કવેરી મુજબના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જેથી ઉમેદવારે સમયાંતરે પાત્રતા માટે [www.gujdiploma.nic.in](http://www.gujdiploma.nic.in) પર પોતાના login-ID માં જોતા રહેવું હિતાવહ છે.

આ જાહેરાત માત્ર ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં સીધા પ્રવેશ માટે (C to D) જ છે.

Official Website: [www.acpdc.co.in/www.gujdiploma.nic.in](http://www.acpdc.co.in/www.gujdiploma.nic.in)

મેમ્બર સેક્રેટરી

હેલ્પ લાઇન નંબર 079- 26566000 (24x7)

તા.01/07/2021